

## વર્ચ્યુઆ હેલ્પ

પ્રસ્તિક શીર્ષક PBS—દર્દીનો હિસાબ		નીતિનું નામ આર્થિક સહાય નીતિ		
પ્રસ્તિકનો માલિક દર્દીનો હિસાબ	પ્રસ્તિક થયાની તારીખ	છલ્લી સમીક્ષાની તારીખ 12/2015 , 08/2024	સુધારની તારીખ 12/2015 , 08/2024	અસરકારક તારીખ 12/2015
સમીક્ષાનો અંતરાલ 12 મહિનાઓ	કોણે સમીક્ષા કરી/મંજૂરી આપી: વર્ચ્યુઆ હેલ્પ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધિકારીઓએ			

### 1. નીતિ

વર્ચ્યુઆની આર્થિક સહાય નીતિ ("FAP")નું ધોય એવા લોકોની સહાય કરવાનો છે જેમની પાસે તેમના માટે અથવા તેઓ જેમના માટે જવાબદાર છે તેમના માટે તેમણે જે કાળજી મેળવી છે તેના માટે ચુકવવા પૂરતાં આર્થિક સંસાધનો (આરોગ્ય વીમા સહિત) નથી. વર્ચ્યુઆની FAP તાત્કાલિક (ઇમજન્સી) અને અન્ય તબીબી રીતે જરૂરી કાળજી સંબંધિત છે. તે બિનતબીબી જરૂરી અથવા પસંદગીની સૌંદર્ય (કોમેટિક) પ્રક્રિયાઓ સંબંધિત નથી. વર્ચ્યુઆ ખાતે જે દર્દીઓ તાત્કાલિક અથવા તબીબી રીતે જરૂરી અન્ય કાળજી મેળવે છે તેમની વર્ચ્યુઆ દ્વારા કાળજી લેવાતી હોય ત્યારે તેમને સામાન્યતઃ ખાનગી ફિલિશિયન ગ્રૂપ્સ અથવા અન્ય ગ્રાહિત આરોગ્યકાળજી પ્રદાતાઓ જુદે છે. અમારી હોસ્પિટલ સુવિધાઓની અંદર તાત્કાલિક અથવા તબીબી રીતે જરૂરી અન્ય સેવાઓ આપનારાઓની સૂચી માટે કુપા કરીને પરિશિષ્ટ A જુદો. પરિશિષ્ટ નિર્દિષ્ટ કરે છે કે આ FAP હેઠળ કથા પ્રદાતાઓ આવરી લેવાયા છે અને કયા નથી. પ્રદાતા સૂચિની દર ત્રણ મહિને સમીક્ષા કરાય છે અને જો જરૂરી હોય તો તેને તાજી કરાય છે.

### 2. આર્થિક સહાય કાર્યક્રમો, લાયકાત અને અરજી કરવા/પ્રક્રિયાઓ માટેની પદ્ધતિઓ

લાયકાતને આધીન, આર્થિક સહાય નીચેના કાર્યક્રમો દ્વારા પ્રાપ્ય હોઈ શકે છે:

- a) મેડિકેછ અને સોશિયલ સિક્યુરિટી જેવા સરકારી કાર્યક્રમો
- b) ન્યૂ જર્સી રાજ્યનો હોસ્પિટલ કાળજી ચુકવણી સહાય કાર્યક્રમ ("HCPAP")

હોસ્પિટલ કાળજી ચુકવણી સહાય માટેનો ભંડોળનો સોત ન્યૂ જર્સી સરકારી કાયદા 1997, પ્રકરણ 263 હેઠળ પ્રશાસિત આરોગ્ય કાળજી સબસિડી ભંડોળ છે. HCPAP મંજૂરીશી ન્યૂ જર્સી રાજ્યમાં એક્યુટ કેર હોસ્પિટલમાં અંદરના દર્દી (ઇનપેશનન્ટ) અને બહારના દર્દી (આઉટપેશનન્ટ) તરીકેની સેવા મેળવતા દર્દીઓને નિઃશુલ્ક અથવા વળતર સાથેની કાળજી મળે છે. હોસ્પિટલ સહાય અને ધરાડેલા દરે કાળજી માત્ર તાત્કાલિક જરૂરી અથવા તબીબી રીતે જરૂરી અન્ય કાળજી માટે જ પ્રાપ્ય હોઈ શકે છે.

દર્દીઓ HCPAP માટે તો જ લાયક હોઈ શકે છે જો તેઓ ન્યૂ જર્સીના રહેવાસી હોય અને:

- i. તેમની પાસે આરોગ્ય કવરેજ ન હોય અથવા કવરેજ હોય પરંતુ તે માત્ર હોસ્પિટલ બિલનો એક ભાગ જ ચુકવતું હોય (વીમા વગર અથવા ઓછા વીમાવાળું);
- ii. તેઓ કોઈ ખાનગી અથવા સરકારી પ્રયોજિત કવરેજ (ઇમ કે મેડિકેછ) માટે લાયક ન હોય; અને
- iii. તેઓ નીચેના આવક તેમજ અસ્ક્યામત લાયકાતનાં ધોરણો જેમાં નીચેનાનો સમાવેશ થાય છે, ધરાવતા હોય:

આવક ધોરણ: સંધીય ગરીબી માર્ગદર્શિકા ("FPG")ના 200% કરતાં ઓછી અથવા તેટલી પારિવારિક કુલ આવક ધરાવતા દર્દીઓ 100% સખાવત કાળજી કવરેજ માટે લાયક છે. 200% કરતાં વધુ પારિવારિક કુલ આવક ધરાવતા પરંતુ 300% કરતાં ઓછી અથવા તેટલી પારિવારિક કુલ આવક ધરાવતા દર્દીઓ વળતર સાથેની કાળજી માટે લાયક છે. નિઃશુલ્ક કાળજી લાગુ થશે કે આંશિક કવર કરાયેલા દરો લાગુ થશે તેનો નિર્ણય ન્યૂ જર્સી આરોગ્ય વિભાગના ફી પત્રકના ઉપયોગ દ્વારા થશે.

અસ્ક્યામત ધોરણ: HCPAPમાં અસ્ક્યામત લાયકાત સીમા રેખાનો સમાવેશ થાય છે જે દર્શાવે છે કે વ્યક્તિગત અસ્ક્યામતો

\$7,500થી વધવી ન જોઈએ અને પારિવારિક અસ્ક્યામતો \$15,000થી વધવી ન જોઈએ.

HCPAP ન્યૂ જર્સીમાં ન રહેતા એવા લોકોને પણ પ્રાપ્ય છે, જેમને તાત્કાલિક તબીબી સ્થિતિ માટે તાત્કાલિક તબીબી ધ્યાન આપવું જરૂરી છે.

જે દર્દીઓ HCPAP માટે અરજી કરવા ઈચ્છતા હોય તેમણે પરિવાર/કુટુંબ માહિતી, ન્યૂ જર્સીમાં રહેવાનો પુરાવો (ફ્રાઇવરનો પરવાનો, કાઉન્ટર ઓળખ પત્ર) અને આવક વેરાનો દસ્તાવેજ (દા.ત. પે સ્ટબ, ફોર્મ W-2, સોશિયલ સિક્યુરિટી સ્ટેટમેન્ટ) અને અસ્ક્યામતો (દા.ત. બેન્ક સ્ટેટમેન્ટ) સહિત સહભાગિતા માટે ન્યૂ જર્સી હોસ્પિટલ કાળજી સહાય કાર્યક્રમ અરજી પૂર્ણ રીતે ભરીને સુપ્રત કરવી જોઈએ. જો દર્દીને કોઈ આવક કે અસ્ક્યામતો ન હોય તો દર્દી દ્વારા અપાયેલું પ્રમાણન (એટેસ્ટેશન) દસ્તાવેજના બદલે ચાલશે.

c) ન્યૂ જર્સી વીમા વગરનું વળતર (સરકારી કાયદો, પ્રકરણ 60)

FPGના 500%થી ઓછી પારિવારિક કુલ આવક ધરાવતા તમામ વીમા વગરના દર્દીઓ આ કાર્યક્રમ હેઠળ વળતરવાળી કાળજી માટે લાયક હોય. આ કાર્યક્રમ હેઠળ લાયક દર્દીને જે આરોગ્યકાળજી સેવાઓ અપાઈ હોય તેના માટે સંધીય તબીબીકાળજી કાર્યક્રમ (કુડરલ મેડિકેર પ્રોગ્રામ) હેઠળ લાગુ પડતા ચુકવણીના દરના 115%થી વધુ નહીં તેટલી રકમનો ચાર્જ કરાશે.

d) NJ પરિવારકાળજી

NJ પરિવારકાળજી એ ન્યૂ જર્સીનો સરકારી ભંડોળથી ચાલતો આરોગ્ય વીમા કાર્યક્રમ છે જેમાં CHIP, મેડિકેઝ અને મેડિકેઝ વિસ્તરણ (એક્સ્પાન્શન) વસતિ (પોષ્યલેશન)નો સમાવેશ થાય છે. NJ પરિવારકાળજી એ ન્યૂ જર્સીના કોઈ પણ ઉમરના લાયક નિવાસીઓને પોસાચ તેવા દરે આરોગ્ય વીમામાં પ્રવેશ આપવા માટે બનાવાયેલો સંઘ અને રાજ્ય દ્વારા અપાતા ભંડોળનો આરોગ્ય વીમા કાર્યક્રમ છે. NJ પરિવારકાળજી એ લોકો માટે છે જેમની પાસે રોજગારદાતા (એમ્પલોયર) વીમો નથી.

NJ પરિવારકાળજી માટે લાયકત માગતા વ્યક્તિઓ માટે નાણાકીય લાયકત સુધારેલી અનુકૂલિત (મોડિફિએડ એડ્જસ્ટેડ) કુલ આવક અથવા MAGI પર આધારિત હોય. વધુ માહિતી અહીંથી મળશે: [www.nifamilycare.org/default.aspx](http://www.nifamilycare.org/default.aspx).

e) ન્યૂ જર્સી કેન્સર શિક્ષણ અને વહેલી તક નિરાન ("NJCEED")

NJCEED કાર્યક્રમ સ્તન, ડોક (સર્વોઇકલ), મળાશય (કોલોરેટરલ) અને પ્રોસ્ટેટ કેન્સર માટે સધન પહોંચ, શિક્ષણ અને સ્કીનિંગ સેવાઓ આપે છે.

લાયક થવા દર્દી વીમા વગરનો/ની હોવો/વી જોઈએ અને તેની પારિવારિક કુલ આવક FPGના 250% અથવા તે કરતાં ઓછી હોવી જોઈએ. વધુ માહિતી અહીંથી મળી શકે છે: [www.nj.gov/health/cancer/njceed](http://www.nj.gov/health/cancer/njceed).

f) બાળકોમાં આપત્તિજનક બીમારી રાહત ભંડોળ

બાળકોમાં આપત્તિજનક બીમારી રાહત ભંડોળ જે પરિવારોના બાળકો આપત્તિજનક બીમારી ધરાવતા હોય તેમને આર્થિક સહાય આપે છે.

લાયક હરવા માટે, હોસ્પિટલના ખર્ચાઓ પરિવારની કુલ આવકના 10% કરતાં વધુ હોવા જોઈએ, ઉપરાંત \$100,000થી વધુ કોઈ પણ આવકના 15% હોવા જોઈએ, જ્યારે તબીબી ખર્ચાઓ થાય ત્યારે બાળક 21 વર્ષ કે તેનાથી નાની ઉમરનું હોવું જોઈએ અને પરિવાર અરજીની તારીખના પહેલાં ત્રણ મહિનાથી ન્યૂ જર્સીમાં રહેતો હોવો જોઈએ. સ્થળાંતરિત કામદારો લાયક હોઈ શકે છે, અસ્થાચી નિવાસી નહીં. વધુ માહિતી અહીંથી મળી શકે છે: [www.state.nj.us/humanservices/cicrf/home](http://www.state.nj.us/humanservices/cicrf/home).

g) ન્યૂ જર્સી અપરાધ પીડિતો વળતર કાર્યાલય

ન્યૂ જર્સી રાજ્યે ન્યૂ જર્સી અપરાધ પીડિતો વળતર કાર્યાલય સ્થાપિત કર્યું છે જેથી અપરાધના પીડિતોને નુકસાન અને ખર્ચ જેમાં કેટલાંક ચોક્કસ અપરાધિક ફાર્માના કારણે થયેલા ચોક્કસ તબીબી ખર્ચાઓનો પણ સમાવેશ થાય છે, માટે વળતર આપી શકાય.

ન્યૂ જર્સી અપરાધ પીડિતો વળતર કાર્યાલય માટે લાયક હરવા, અપરાધ ન્યૂ જર્સીમાં થયો હોવો જોઈએ અથવા તે ન્યૂ જર્સીના નિવાસી,

જેની સમે અપરાધ રાજ્ય બહાર થયો છે, તેને સંબંધિત હોવો જોઈએ, પીડિતે 9 મહિનાની અંદર પોલીસને અપરાધની જાણ કરી હોવી જોઈએ અને પીડિતે અપરાધની તપાસ અને કાર્યવાહીમાં સહકાર આપવો જોઈએ. દાવો (ક્લેઇમ) અપરાધની તારીખના 3 વર્ષની અંદર દાખલ કરવો જોઈએ અને દર્દી અપરાધનો/ની નિર્દોષ પીડિત/પીડિતા હોવો/વી જોઈએ. વધુ માહિતી અહીંથી મળી શકે છે: [www.nj.gov/oag/njvictims/index.html](http://www.nj.gov/oag/njvictims/index.html).

h) ABG

IRCની કલમ 501(r)(5) મુજબ, તાત એલિક અથવા તબીબી રીતે જરૂરી અન કાળજીના કિસ માં, જેમને આવી કાળજી માટે વીમા કવરેજ હોય તે વ ક્રી ઓને સામાન રીતે જે બિલ કરાય તે રકમથી વધુ રકમનો ચાર્જ લાયક દર્દીઓ પર નહીં કરાય. જો દર્દીઓ વીમો ન ધરાવતા હોય અને તેમની પારિવારિક આવક FPGના 500% કરતાં ઓછી હોય તો તેઓ આ વળતર માટે લાયક હોઈ શકે છે. વધુમાં, ઓછો વીમો ધરાવતા દર્દીઓની જો પારિવારિક કુલ આવક FPGના 200% કરતાં વધુ પરંતુ 300% કરતાં ઓછી અથવા સમાન હોય તો તેઓ લાયક હોઈ શકે છે.

i) વચ ર આનો સખાવત સહાય કાયકરરરમ ("CAP")

વીમો ન ધરાવતા દર્દીઓ કે જે મેડિકેન્ડ માટે લાયક નથી અને જે HCPAP હેઠળ 100% વળતર માટે પણ લાયક થઈ શકતા નથી તેઓ CAP માટે લાયક હોઈ શકે છે, જો તેઓ અમેરિકાના નાગરિક હોય અને તેમની પારિવારિક કુલ આવક FPGના 500% કરતાં વધુ ન હોય. CAP હેઠળ જે લોકો સહાય માટે લાયક હરે છે તેમને તાત એલિકત અથવા જરૂરી તબીબી પરરકિરરચાઓ માટે ચાર્જ કરાયેલી રકમના 90%ટતર મળશે.

CAP હેઠળ આંશિક સહાય માટે અરજી કરવા, સખાવત સહાય કાયકરરરમ અરજી સુપરરત કરવી જોઈએ. CAP અરજદારોએ પરિવાર/કુટુંબની માહિતી તેમજ આવકના દસ એજ્જ પુરાવા (HCPAPની કલમ 2(b)માં સમાવાયેલા આવકના પુરાવાના ઉદાહરણો જુદ્ધો) આપવું જોઈએ. ન્યૂ ઝરી સહભાગીતા માટે હોસ્પિટલ કાળજી સહાય કાર્યક્રમ અરજી અને વર્ચ્યુઅસ સખાવત કાર્યક્રમ અરજી ("અરજીઓ")ને વર્ચ્યુઅસની વેબસાઇટ [www.virtua.org](http://www.virtua.org) પર વર્ચ્યુઅસ સખાવત સહાય કાર્યક્રમ (ચેરિટી આસિસ્ટન્સ પ્રોગ્રામ) પરથી નીચે ઉતારી (ડાઉનલોડ કરી) શકાય છે.

અમારા ગ્રાહક સેવા મંડળ (બ્યુરો)ને (800) 418-5685 પર ફોન કરીને અરજીની કાગળવાળી નકલો પ્રાપ્ત કરી શકાય છે.

જરૂરી દસ્તાવેજો સહિત પૂરી કરેલી અરજીને સુપ્ત કરવા દર્દીઓ પાસે પહેલા ડિસ્ચાર્જ પછીના બિલની તારીખથી 365 દિવસ હશે.

ફૂપા કરીને પૂરી કરેલી અરજીઓ (જરૂરી તમામ દસ્તાવેજો સાથે) નીચેના સરનામા પર મોકલો:

Virtua Patient Accounting  
2000 Crawford Place, Suite 100  
Mount Laurel, NJ 08054

જો અપ્પુર્ણ અરજી મળશે તો વર્ચ્યુઅસ દર્દીને લેખિત સૂચના (નોટિસ) મોકલશે જેમાં લખેલું હો કે FAP-લાયકાત નિર્ણય કરવા માટે વધુ માહિતી/દસ્તાવેજ જરૂરી છે અને દર્દીને વિનંતી કરાયેલા દસ્તાવેજ આપવા વાજબી સમય (30 દિવસો) આપશે. વર્ચ્યુઅસ દર્દીને આ FAPના સાદા ભાષા સારાંશ ("PLS")ની એક નકલ પણ આપશે. PLS એ લેખિત નિવેદન છે જે વ્યક્તિને સ્થુચિત કરે છે કે વર્ચ્યુઅસ FAP હેઠળ આંશિક સહાય પ્રસ્તાવિત કરે છે અને સ્પષ્ટ, લઘુ અને સમજવામાં સરળ ભાષામાં વધુ માહિતી આપે છે. વધુમાં, વર્ચ્યુઅસ અને વર્ચ્યુઅસ વતી કામ કરતો કોઈ પણ ત્રાહિત પક્ષ વાજબી સમય માટે ચુકવણી મેળવવા કોઈ પણ પણ અસાધારણ વસુલી કાર્યો ("ECAs")ને અટકાવી દેશે.

### 3. ચાર્જ કરાયેલી રકમ ગણવાનો આધાર

લુક-બેક મેથડનો ઉપયોગ કરીને વર્ચ્યુઅસ વાંશિક ધોરણે તેની હોસ્પિટલ સુવિધાઓ માટે AGB ટકાવારી સ્થાપિત કરશે. AGB ટકાવારી સેવા માટે મેડિકેર ફી કાર્યક્રમ + ખાનગી આરોગ્ય વીમા કંપનીના દાવાને આ દાવા સાથે સંકળાયેલા કુલ ચાર્જ દ્વારા ભાગને ગણવામાં આવે છે. તેનું જે પરિણામ આવે તે AGB ટકાવારીને AGB રકમ નક્કી કરવા નિર્દિષ્ટ પ્રક્રિયા માટે કુલ ચાર્જ દ્વારા ગુણવામાં આવે છે.

અમારા ગ્રાહક સેવા મંડળને (800) 418-5685 પર ફોન કરીને વિનંતી કરવાથી ગણાયેલી AGB ટકાવારી તેમજ તેની સાથે ટકાવારીનું વર્ણન નિઃશુલ્ક

મળે છે.

FAP-લાયક તરીકે નક્કી કરાયેલી વ્યક્તિ પર IRC કલમ 501(r)(5) મુજબ તાત્કાલિક અને તબીબી રીતે જરૂરી અન્ય આરોગ્યકાળજી સેવાઓ માટે AGB કરતાં વધુ ચાર્જ નહીં લગાવવામાં આવે. AGB એ FAP-લાયક વ્યક્તિને ચાર્જ કરાતી મહત્વમાં રકમ છે. આ FAP મુજબ, FAP-લાયક વ્યક્તિને AGB કરતાં ઓછો અથવા આ FAP હેઠળ તેઓ જેના માટે લાયક ઢરે તે અન્ય કોઈ વળતરવાળા દરનો ચાર્જ કરાશે.

#### 4. FAPનો બહોળો પ્રચાર

વર્ષ્યુઆનો દર્દી હિસાબ વિભાગ આંશિક સહાય માટે વ્યક્તિ લાયક છે કે કેમ તે નક્કી કરવા વાજબી પ્રયાસોનો ઉપયોગ કરીને ન્યાયી અને સાત્ત્યસભર આંશિક સહાય આપવા તેના શ્રેષ્ઠ પ્રયાસો કરશે. વર્ષ્યુઆએ આપણા દર્દીઓની આંશિક સહાય માટેની જરૂરિયાતો અને આપણી પોતાની વ્યાપક નાણાકીય જવાબદારી વચ્ચે સંતુલન કરવું જ જોઈએ તેથી સહાય એ અંગત જવાબદારીની જગ્યા ન લઈ શકે. જ વ્યક્તિએ તેમની કાળજી માટે ચુકવવા નાણાકીય સાધનો ધરાવતા હોવાનું જણાય તેમની પાસે તેમ કરવા અપેક્ષા છે અને વર્ષ્યુઆ જરૂરી હોય તેમ તેની અસ્ક્રામતોની રક્ષા કરવા કાયદા હેઠળ અનુમતિ હોય તેવાં પગલાં લેવાનો અધિકાર અભાદ્રિત રાખે છે.

આપણા દર્દીઓના લાભ માટે, આપણો FAP, અરજીઓ અને PLS વર્ષ્યુઆની વેબસાઇટ [www.virtua.org](http://www.virtua.org) પર પ્રાપ્ય છે.

FAP, અરજીઓ અને PLSની કાગળ નકલો અમારી હોસ્પિટલ સુવિધાઓના નીચેના જહેર સ્થળો પર વિનંતી કરવાથી નિઃશુલ્ક મળી શકશે:

- તાત્કાલિક (ઇમરજન્સી) રૂમ;
- બહારના દર્દી (આઉટપેશન્ટ) નોંધણી; અને
- પ્રવેશ નોંધણી.

ઉપરાંત અમારા ગ્રાહક સેવા મંડળને (800)418-5685 પર ફોન કરીને FAP, અરજીઓ અને PLSની કાગળ નકલો માળી શકાય છે.

વર્ષ્યુઆએ આપણા દર્દીઓ અને સમુદાયના સહ્યોને પ્રાપ્ય આંશિક સહાયની સૂચના અને માહિતી આપવાના પ્રયાસમાં જહેર હોસ્પિટલ સ્થળોએ પ્રમુખ રીતે પ્રદર્શનો ઊભાં કર્યા છે.

વર્ષ્યુઆ આંશિક સહાયની પ્રાપ્યતા વિશે સમુદાયના સહ્યોને માહિતી આપવાના તમામ વાજબી પ્રયાસો પણ કરશે.

પ્રવેશ અથવા છૂટવાની (ડિસ્ચાર્જ) પ્રક્રિયાના ભાગ રૂપે વર્ષ્યુઆ PLSની એક નકલ પણ પ્રસ્તાવિત કરશે.

વર્ષ્યુઆની પ્રાથમિક સેવા વિસ્તારમાં તમામ મહત્વની વસતિનો સમાવેશ કરવાના પ્રયાસમાં FAP, અરજીઓ અને PLS એ બધું અંગેજુમાં તેમજ અંગેજુમાં મર્યાદિત નિપુણતા ("LEP") ધરાવતી વસતિ, જે 1,000 લોકો અથવા વર્ષ્યુઆની સેવા મેળવતા સમુદાયના 5%, ની મુખ્ય ભાષામાં પ્રાપ્ય છે.

#### 5. બિલિંગ અને વસુલી નીતિ

વર્ષ્યુઆ તેના બિલિંગ અને વસુલી કિયાઓના સંદર્ભમાં તમામ નિયમનો અને તે સંદર્ભમાં કરારની સંમત થયેલી જોગવાઈઓનું પાલન કરશે. તમામ હિસાબોના સંદર્ભમાં ચુકવણી મળે તે સુનિશ્ચિત કરવા બિલિંગ અને તે પણીનું ઝોલોઅપ કરવા માટે દર્દી હિસાબ વિભાગ જવાબદાર હોશે. જો બાકી રકમ માટે મુખ્ય જવાબદારી સાથે ચુકવણાર દ્વારા ચુકવણીના પગલે શેષ રકમ બાકી હોશે (દા.ત. કપાત પાત્ર અથવા કોઈસ્ટ્યોરન્સ રકમ) તો હિસાબ બેલેન્સ માટે ડિન્ટિય જવાબદારી સાથે શેષ હિસાબ બેલેન્સ પક્ષ (પાર્ટીના નામે બિલ કરી દેવાશે. જે દર્દીઓ વીમો ધરાવતા નથી અથવા શેષ બેલેન્સ માટે ઓછું વીમા કવરેજ ધરાવે છે, તેવા દર્દીઓના સંદર્ભમાં વર્ષ્યુઆ ત્યાં સુધી કાળજી માટે ચુકવણી મેળવવા વ્યક્તિ સામે અસાધારણ વસુલી કાર્યો ("ECAs") નહીં શરૂ કરે જ્યાં સુધી વર્ષ્યુઆના FAP હેઠળ સહાય માટે વ્યક્તિ લાયક છે કે નહીં તે નક્કી કરવા વાજબી પ્રયાસો ન થાય.

એ દર્દીઓ જેમના માટે કોઈ ઓળખાયેલા ત્રાહિત આરોગ્ય વીમા કવરેજ નથી તેમના હિસાબો એ હેઠળ પ્રસ્તાવિત વળતરની પ્રાયતાથી જવાબદાર પક્ષને જાગૃત કરવા સાથે વ્યાખ્યાયિત સ્વચુકવણી વસુલી ચકને અનુસરશે.

એકવાર પૂરી કરેલી FAP અરજી મળી જાય, તે પછી વર્ચ્યુઆ:

- વ્યક્તિ સામે કોઈ પણ ECA અટકાવી દેશે (વર્ચ્યુઆ વતી કામ કરતા ત્રાહિત પક્ષો (પાર્ટી) પણ હાથ ધરેલા ECAને અટકાવી દેશે;
- સમયબદ્ધ રીતે FAP-લાયકાત નિર્ણય કરશે અને તેનું દસ્તાવેજુકરણ કરશે; અને
- જવાબદાર પક્ષ (પાર્ટી)ને નિર્ણય તેમજ નિર્ણયના આધારની લેખિતમાં સૂચના આપશે.

જો દર્દી FAP-લાયક જણાશે તો વર્ચ્યુઆ:

- FAP-લાયક વ્યક્તિને જે રકમ ભરવાની છે, આ રકમ કઈ રીતે નક્કી કરવામાં આવી અને AGBને સંબંધિત માહિતી કઈ રીતે મેળવાઈ તે સૂચવતું બિલિંગ સ્ટેટમેન્ટ આપશે;
- વ્યક્તિ દ્વારા કરાયેલી કોઈ પણ વધારાની ચુકવણીને પરત આપશે; અને
- દેવું વસુલવા દર્દીઓ સામે લેવાયેલા કોઈ પણ ECAને ઉલટાવવા ત્રાહિત પક્ષ (પાર્ટીઓ) તમામ વાજબી પ્રાપ્ય પગલાંઓ દેશે.

વ્યાખ્યાયિત સ્વ-ચુકવણી વસુલી ચક (પહેલા ડિસ્પાર્ટ પછીના બિલની તારીખથી 120 દિવસો)ના અંતે ચુકવણીની વ્યવસ્થાઓ કરવાની અથવા આંગ્નિક સહાય માટે મંજૂરીની પ્રક્રિયામાં ન હોય તેવા બાકીના કોઈ પણ નહીં ચુકવાયેલા હિસાબો ત્રાહિત પક્ષ સંસ્થા ("સંસ્થા")ને વસુલી માટે હસ્તાંતરિત (દ્રાન્ડફર) કરી દેવામાં આવશે. આ હસ્તાંતરણ પહેલાં જોકે જવાબદાર પક્ષ (પાર્ટી)ની વાર્ષિક આવકનો અંદાજ બહારની ઘિરાણ સંસ્થા પાસેથી મેળવી શકાય છે. આવકના અંદાજ પરથી જો એવું નક્કી કરી શકશે કે વ્યક્તિ FAP-લાયક છે, તો ચાર્જમાં ઉપર ઉલ્લેખિત ઘટાડો લાગુ કરશે અને બાકીનું ચોખ્યું બેલેન્સ સંસ્થાને વસુલી માટે હસ્તાંતરિત કરી દેવામાં આવશે. વધુમાં, સંભવિત FAP-લાયકાત નિર્ણયના આધાર અંગે વર્ચ્યુઆ વ્યક્તિને સૂચિત કરશે.

સંસ્થા પાસે હિસાબ 180 દિવસો માટે રહેશે. આ સમયગાળા પછી, બાકી રકમનું બેલેન્સ મેળવવાની વ્યવસ્થા ન થતાં વર્ચ્યુઆ કે તેના વતી કોઈ ગ્રેજા પક્ષો (પાર્ટી) નીચેનાં ECA હાથ ધરી શકે છે:

- ગ્રાહક ઘિરાણનું વૃત્તાંત આપતી સંસ્થાઓ અથવા ઘિરાણ મંડળો (બ્યુરો)ને વ્યક્તિ વિશે પ્રતિક્રિય માહિતીનું વૃત્તાંત જણાવવું;
- વ્યક્તિની સંપત્તિ પર ગ્રહણાપિકાર મૂકવો;
- વ્યક્તિનું બેન્ક ખાતું અથવા અન્ય અંગત સંપત્તિ ટાંચમાં લેવી અથવા જપ્ત કરવી;
- વ્યક્તિ સામે કોઈ નાગરિક કાર્ય શરૂ કરવું; અને
- વ્યક્તિના પગારને કાયદાકીય જપ્ત કરવા નોટિસ આપવી (ગાન્નિશિંગ).

120 દિવસના અધિસૂચના (નોટિફિકેશન) સમયગાળા પછી દર્દીના બાકી હિસાબો અંગે ECA શરૂ કરવા વર્ચ્યુઆ વસુલી સંસ્થાઓ અને વર્ચ્યુઆ વતી કામ કરતા એટનીઓને અધિકૃત કરી શકે છે. ECA શરૂ કરતા પહેલાં FAP હેઠળ આંગ્નિક સહાય માટે વ્યક્તિ લાયક છે કે કે કેમ અને નીચેનાં પગલાં લેવાયાં છે કે કેમ તે નક્કી કરવા વર્ચ્યુઆ વાજબી પ્રયાસો સુનિશ્ચિત કરશે.:

- દર્દીને લેખિત સૂચના (તમામ બિલિંગ સ્ટેટમેન્ટ સહિત) આપાઈ છે, જેમાં:
  - લાયક દર્દીઓ માટે આંગ્નિક સહાય પ્રાપ્ય છે તે સૂચવેલું છે;
  - કાળજી માટે ચુકવણી મેળવવા વર્ચ્યુઆ જે ECA શરૂ કરવા ધારે છે તે ઓળખાયેલાં છે; અને
  - એક અંતિમ તારીખ જણાવે છે જેના પછી આવાં ECA શરૂ કરી શકાય છે.
- દર્દીને તેના તજા બિલિંગ સ્ટેટમેન્ટ સાથે PTDની એક નકલ મળી છે; અને
- વ્યક્તિને FAP વિશે અને વ્યક્તિ આંગ્નિક સહાય અરજી પ્રક્રિયા સાથે કઈ રીતે સહાય મેળવી શકે છે તે અંગે મૌખિક સૂચના આપવા વાજબી પ્રયાસો કરાયા છે.

## ગ્રાહિત પક્ષનો વીમો

1. વર્ચ્યુઆ મેડિકેર અને મેડિકેઇન બિલ મોકલશે;
2. વર્ચ્યુઆ દર્દી વતી તમામ ગ્રાહિત પક્ષ વીમા કંપનીઓને બિલ મોકલશે. વર્ચ્યુઆ દર્દીઓનો તેમણે નહીં ચુકવેલા વીમા બેલેન્સ અંગે સંપર્ક સાધવાનું શરૂ કરે તે પહેલાં વીમા કંપનીઓને ચુકવણી આપવા 45 દિવસનો સમય અપાશે;
3. વર્ચ્યુઆ મોટર ક્લિકલ અને ક્રમદારો વળતર દાવાને આવરી લેતા ત્રીજા પક્ષો (પાર્ટી)ઓને બિલ મોકલશે; અને
4. જો ચુકવણી નહીં મળે તો દર્દીઓ તેમના બિલો માટે અંતિમ રીતે જવાબદાર હ્યો સિવાય કે કરાર કે નિયમનો દ્વારા પ્રતિબંધિત હોય.

## વીમા ન હોય, વણાઉંટનું અને સ્વચુકવણી બેલેન્સ

1. EMTALA (તાત્કાલિક તબીબી સારવાર અને સક્રિય પ્રસવ કાયદો) હેઠળ આવરી લેવાગેલી આકસ્મિક, તાત્કાલિક અને પ્રસવ તથા પ્રસૂતિ સેવાઓ અગાઉની ચુકવણીને આધીન નથી. વર્ચ્યુઆ એવા કોઈ કાર્યો નહીં કરે જેનાથી વ્યક્તિ તાત્કાલિક તબીબી કાળજી માગવાથી હતોત્સાહ થાય જેમ કે તાત્કાલિક તબીબી સ્થિતિઓ માટે સારવાર મેળવતા પહેલાં તાત્કાલિક વિભાગ દર્દીઓ પાસે ચુકવણીની માગણી કરવી અથવા તાત્કાલિક વિભાગ કે અન્ય વિસ્તારો જ્યાં આવી પ્રવૃત્તિ તાત્કાલિક કાળજી તટસ્થ રીતે આપવાની જોગવાઈમાં દખલ કે તેમ હોય ત્યાં દેવું વસુલીની પ્રવૃત્તિઓને અનુમતિ આપવી.
2. સેવાના સમય સુધીમાં જાણીતા કપાત, આવરી લેવાગેલી સેવાઓ માટે નિર્ધારિત ચુકવણી (ડોપે) અને કોઇન્સ્ટ્યોરન્સ રકમ માટેની ચુકવણી બાકી હોય.
3. નહીં આવરાગેલા, વીમો ન કરાયેલા અને “જીવનશૈલી”ની સેવાઓ માટેની ચુકવણી સેવાના સમય સુધીમાં ચુકવણીને પાત્ર છે (જીવનશૈલી પ્રક્રિયાઓની વ્યાખ્યા તબીબી રીતે બિનજરૂરી પ્રક્રિયાઓ જેમ કે પુનઃ સ્થાપી ન શકાય તેવી સૌદર્ય (નોન રિસ્ટોરેટિવ કોર્સેમેન્ટ) શક્ષક્રિયા તરીકે કરવામાં આવે છે.).
4. દર્દીનું બેલેન્સ જે સેવા પહેલાં ચુકવી શકાય તેમ નથી અને વીમાની ચુકવણી પછી અથવા ઈનકાર પછી બાકી બેલેન્સ નીચેની કોઈ પણ એક પદ્ધતિ દ્વારા ઉકેલી શકાય છે:
  - a. અંગત ભંડોળ, કેદિટ કાર્ડમાંથી પૂરી ચુકવણી;
  - b. મર્યાદિત મુદ્દત સમય ચુકવણીઓ (જુઓ ચુકવણી વ્યવસ્થા નીતિ); અથવા
  - c. મંજૂર આથીક સહાય. (જુઓ વર્ચ્યુઆનો FAP)
5. એક વાર હિસાબ બેલેન્સ દર્દીની જવાબદારી બની જાય તે પછી 3-5 કામકાજી દિવસોમાં દર્દીને એક સ્ટેટમેન્ટ મેઇલ કરવામાં આવશે. આ તારીખ અધિસૂચના (નોટિફિકેશન) સમયગાળાની શરૂઆત દર્શાવે છે. “અધિસૂચનાનો સમયગાળો” 120 દિવસનો સમયગાળો છે જેની અંદર દર્દી સામે કોઈ ECA શરૂ કરવામાં નહીં આવે.
6. આ સમયે વર્ચ્યુઆના સ્વચુકવણી વેપારી (વેનડર) તેમનું બિલિંગ ચક શરૂ કરવા માટે હિસાબમાં સક્રિય તારીખ દાખલ કરશે.
  - a. દર્દીને 3 પત્રો મળશે. આ પત્રોમાં ઉપરોક્ત ચુકવણી વિકલ્પો તેમજ વર્ચ્યુઆના FAP અંગે માહિતીનો સમાવેશ હોય. વસુલીને હિસાબ મોકલતા પહેલાં દર્દીને ફોન કોલ/પ્રયાસો કરવામાં આવશે. આ પગલાંઓ તમામ હિસાબોને તેની પ્રક્રિયા કરવા અનુમતિ આપશે;
  - b. દર્દીને પ્રારંભિક ડિસ્ચાર્જ પછીના બિલથી ઓછામાં ઓછા 120 દિવસો સુધી વસુલી સંસ્થાને હસ્તાંતરરણ નહીં થાય;
  - c. અચોકકસ સરનામાંઓ સાથેના હિસાબો તેમજ જે દર્દીઓ મુત્ય પામ્યા છે તેમના સંબંધિત હિસાબો વસુલી સંસ્થાઓને હસ્તાંતરિત કરી શકાય છે જો હિસાબ પર સમર્થનકારી સંશોધન દસ્તાવેજો હોય. ખોટાં સરનામાંઓ માટે તેમજ કુટુંબ/સંપત્તિ ન ધરાવતા મૃત દર્દીઓ માટેની યોગ્ય કાર્યવાહી અનુસરવી જોઈએ અને હિસાબ પર તેનું દસ્તાવેજુકરણ થયું જોઈએ.
7. વસુલી સંસ્થાને મોકલતા પહેલાં, વીમો નહીં ધરાવતા તમામ વ્યક્તિઓના હિસાબોની વર્ચ્યુઆના CAPના સંદર્ભમાં આવક લાયકાત માટે

અકાસણી થાય છે. જો લાયક હોય તો, વસુલી સંસ્થાને મોકલતા પહેલાં ડિસાબોન્ઝ એડજસ્ટમેન્ટ કરાય છે.